

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૩/૨૦૧૬ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૦૬/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી ૩૩ વ્યક્તિઓને ઝડપી ૬૯ લીટર દેશી દારૂ, ૧૧૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયરટીન અને ૦૧ એક્ટીવા સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૧૦ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૯,૩૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૦૭/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૫૦૮/૧૬

સોલા હાઇકોર્ટ : સોનુબહેન રમેશભાઈ વાલ્મીકી (ઉ.વ.૧૪)(રહે.સરસ્વતીનગર વિભાગ-૪, ન્યુ રાણીપ સાબરમતી) ને તા.૧૬/૩/૧૬ બપોરનાં ૧૨/૦૦ થી ૩/૦૦ વાગ્યા દરમિયાન આરોપી જગદીશભાઈ આત્મારામ રાવળ (રહે.ત્રાગડ હોડકાનાં મકાનમાં, ચાંદખેડા) લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ સોનુબહેનની માતા તારાબહેન વાલ્મીકીએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.બી.સૈયદ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૫૦૯/૧૬

મણીનગર : રેખાબહેન કિશનચંદ કિશનચંદાની (ઉ.વ.૬૨)(રહે.શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, રમણનગર પાસે, મણીનગર) એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૩/૧૬ સાંજના ૭/૧૫ થી તા.૧૭/૩/૧૬ સવારના ૭/૩૦ વાગ્યા દરમિયાન મણીનગર ગણપતી ગલી, નર-નારાયણ સોસાયટીમાં ખાતે આવેલ પોતાના મકાન નંબર-૦૨ ની લોખંડની જાળી તથા લાકડાના દરવાજાના નકુચાઓ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોનાનાં દાગીના, ઘડીયાળ અને રોકડ રૂપિયા ૪૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૯૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એન.એસ.દેસાઈ ચલાવે છે.

ચાંદખેડા: નરબા ડો/ઓ સુખરામભાઈ ગરાસિયા (ઉ.વ.૨૧)(રહે, નિર્માણરી-જોઇસ સાઇટ ઉપર, જગતપુર, ચાંદખેડા) નાઓ નિર્માણરી-જોઇસની સાઇટ ઉપર મજૂર તરીકે કામ કરતાં હતા દરમ્યાન તા.૧૭/૩/૧૬ બપોરના ૧૨/૩૦ વાગ્યાના સુમારે કોઇ કારણસર સાઇટનાં ઉપરનાં કોઇપણ માળેથી નીચે પટકાઇ જતાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.વાઢેર ચલાવે છે.

બાપુનગર : પ્રવિણભાઈ વશરામભાઈ ચોડેગશ (ઉ.વ.૩૩)(રહે.મયુરપાર્ક સોસાયટી, હિરાવાડી, બાપુનગર) એ પોતાનો કામ-ધંધો બરાબર ચાલતો ન હોઇ, કંટાળી જઇ તા.૧૭/૩/૧૬ સવારના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે અનાજમાં નાંખવાની ગોળી પી જતાં, સારવાર અર્થે તેમને સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સાંજનાં ૬/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી ગોવિંદભાઈ જીવાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.